

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન યોજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

બ્રમ્પટન, ઓન્ટારિયો (20 ફેબ્રુઆરી 2020) – એક પ્રરણાદાયી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે સીટી ઓફ બ્રમ્પટન સાથે જોડાવ જેમાં રવિવારે, માર્ચ 8મીએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રજૂ થશે વર્કશોપ્સ, ઉત્સવને વધાવતી સહેલ, લાઈવ ભજવણીઓ અને અલ્પાહાર

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown), રિજનલ કાઉન્સિલર રોવેના સાન્તોસ (Rowena Santos) અને સીટી કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) યજમાનપદ સંભાળશે ત્યારે ઉજવણીમાં માર્સ્ટર ઓફ સેરિમની તરીકે સિટીટીવીના ક્રિસ્ટિના હોવોરન (Cristina Howorun) હશે અને કીનોટ વક્તા માનનીય ઝૉ ઓગસ્ટિન (Jean Augustine) હશે જેઓ મેમ્બર ઓફ ક્વિવન્ટ્સ પ્રાઈવી કાઉન્સિલ છે અને જેઓ કમ્પેનિયન ઓફ દ ઓર્ડર ઓફ કેનેડા છે. શ્રીમતિ ઓગસ્ટિને 1993માં ઇતિહાસ રચ્યો હતો જ્યારે તેઓ કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં ચુંટાયેલ સહુ પ્રથમ આફ્રિકન-કેનેડિયન મહિલા બન્યા.

નીચે આપેલ છે તે મુજબ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ઓન્ટા ક્લબ ઓફ બ્રમ્પટન, વર્કશોપ્સની શ્રેણી પ્રસ્તુત કરશે:

- બિઝનેસમાં સફળ મહિલાઓ (Successful Women in Business)
- રાજનીતિમાં શક્તિશાળી મહિલાઓ (Powerful Women in Politics)
- જાતિ સમકક્ષતા, સમાનતા અને હિમાયત માટેની લડત (Fighting for Gender Equity, Equality and Advocacy)
- માતાઓનું સશક્તિકરણ (Empowering Mothers)
- યુવાધન અને કિશોરોને પ્રવૃત્ત કરવા વિષયક (Engaging Youth and Teens)
- મન, આત્મા, આરોગ્ય અને સુખાકારી (Mind, Soul, Health and Well-being)
- સંસ્કૃતિ અને ધર્મમાં પ્રેરણાદાયી મહિલાઓ (Inspiring Women of Culture and Faith)
- STEM ની મહિલાઓ (Women in STEM)

વર્કશોપ્સની હાજરી નિઃશુલ્ક છે પરંતુ રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. જે લોકોને હાજર રહેવામાં રુચિ હોય તેઓને અહીં RSVP કરવા જણાવવામાં આવે છે corporate.events@brampton.ca જે ફેબ્રુઆરી 28 સુધીમાં કરવાનું રહેશે.

ડેઈલી ટાઈમ્સ સ્કવેર (Daily Times Square)થી શરૂ કરી, ક્વિન સ્ટ્રીટમાંથી (Queen Street) થઈને, મેઈન સ્ટ્રીટ સાઉથ (Main Street South)માંથી પસાર થઈને ઉત્સવને વધાવતી સેલેબેરટરી વોક સિટી હાલ એટ્રિયમ (City Hall Atrium) ખાતે બપોરે 12 વાગ્યે

પહોંચશે જેમાં બધાંને સહભાગી થવા આમંત્રણ છે. સત્તાવાર વીધિ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે જેમાં રજૂ થશે ભાષણો, ભજવણીઓ અને બ્રમ્પટન સીટી કાઉન્સિલના ભૂતકાલીન અને વર્તમાન મહિલા સદસ્યોનું ઔપચારિક બહુમાન.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સિદ્ધિઓને વધાવતો વૈશ્વિક દિન ગણાય છે. તે લૈંગિક સમાનતાને વેગ આપવાનો કોલ આપતો દિન પણ ગણાય છે. આ વર્ષના ઝુંબેશની થીમ #EachforEqual છે.

સીટી ઓફ બ્રમ્પટનના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca.

અવતરણો

"બ્રમ્પટનના પચરંગી સમાજ વધુ ઉન્નત બન્યું છે તે આપણા શહેરની મહિલાઓના અપાર યોગદાનને આભારી છે તેમજ બ્રમ્પટન સીટી કાઉન્સિલમાં સેવા આપી ચુકેલ જબરદસ્ત મહિલાઓ તો ખરી જ. આ પ્રસંગ એક એવી તક ઊભી કરશે જેથી અહીં બ્રમ્પટન ખાતે, આખા કેનેડામાં અને વિશ્વભરમાં જે કંઈ પણ મહિલાઓ દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે તેને બિરદાવતો એક પ્રસંગ બની રહે.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"પીલ રિજનમાં ચુંટાયેલ સહુ પ્રથમ દ્વિલિપિનો હોવાથી આ ઉજવણીનું સહ-યજમાનપદ વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે. આવા પ્રસંગો મહિલાઓ પર થતી હિંસાનો અંત લાવાવાના આપણા મજબૂત એવા શૈક્ષણિક અને હિમાયતી પ્રયાસોમાં જન ફૂકે છે. મને આશા છે કે બ્રમ્પટનના તમામ વૈવિધ્યપૂર્ણ સમાજોના સ્ત્રી પુરુષો અમારી સાથે મહિલાઓની સિદ્ધિઓ બિરદાવવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનમાં અમારી સાથે જોડાશે, અમારા વર્કશોપ્સમાં ચર્ચાઓમાં જોડાશે અને વધુ લૈંગિક સમકક્ષતા ધરાવતું વિશ્વ બનાવવાના પ્રયાસ ચાલુ રાખશે.

- રોવેના સાન્તોસ રીજનલ કાઉન્સિલર વોર્ડ 1 & 5

"બ્રમ્પટનની પ્રથમ અશ્વેત મહિલા કાઉન્સિલર તરીકે મને સહ યજમાનપદ સંભાળતા ગર્વની લાગણી થાય છે જેમાં મારી પહેલા કાર્યરત મહિલાઓને બિરદાવાશે જેમણે તો જાણે અગ્નિપથને પાર કરી બતાવ્યો છે. માનનીય જૉ ઓગસ્ટિનની શિક્ષણ, રાજનીતિ અને સામાજિક કામોની અનેક સિદ્ધિઓ જેવા અદ્ભૂત ઉદાહરણો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિન આપણી તમામ સિદ્ધિઓને વધાવી લેવાની તક બની રહેશે."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7 & 8

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca